

Chirophobia fear of Hand phobia

Symptoms



Shortness of breath

Anxiety

Rapid Heart Beat

Hands Fear

Dizziness

Causes



Learned Fear

Anxiety Disorder

Genetic Factors

Environmental


Trauma



Drawing by Vimal Kumar

આધ્યાત્મિક મનોવિજ્ઞાન

સાત આંતરિક ઇન્દ્રિયાં (અનુભૂતિ દ્વિસંવેદન)




ધ્યાન કરવાના ફાયદા:-

- * ધ્યાન કરવાથી અંકગણનાની સાથે ચિંતાર અને ધ્યાન લાગડવા મોટા પ્રમાણે ઓછા થાય છે.
- * ધ્યાન કરવાથી તણાવ, ચિંતા, ભય ઓછા થાય છે.
- * કુદરતી કર્મ લિખાનો ને અંકગણનામાં મદદ કરે છે.
- * ધ્યાન કરવાથી વાસ્તવિક જીવનને જીવવાની રીતે સમર્થ થાય છે.
- * ધ્યાન કરનાર વ્યક્તિ અંકગણના હોય છે.
- * ધ્યાન કરવાથી માનસિક સ્થિતિમાં વધારો થાય છે.
- * ધ્યાન કરવારવાથી દિલ્લેથી કાઢી વધારે સ્વચ્છ થાય છે.




ધ્યાનથી દિલ્લેથી ના સંકલન



Telepathy


દિલ્લેથી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ફ્રેડરિક ડબલ્યુ. એચ. માર્ચસ દ્વારા 1882માં કરવામાં આવ્યો હતો.

- * દિલ્લેથી ની અર્થ :-
દેલ :- અર્થ 'દૂર'
પેથી :- અર્થ 'લાગણી' 'અનુભવ'
- * વ્યાખ્યા :-
"દિલ્લેથી અર્થે ઉદાહરણ આધાર ઉપરથી વિના પોતાની વિચારો બીજા સુધી પહોંચાડવા અને બીજાના વિચારોને સ્વીકારવા....."
- * દિલ્લેથી એ લાવિયની દરનાની પુર્વ સૂચન છે.....
- * આંતરગાની સંવેદના માંથી બગાડના ચેતકોથી દારા પકડવામાં આવે છે અને લાવિયની આગળી સંકલનને છે.




Telepathy Type:-

1. Thought
 2. Dream
 3. Synchronicity of Numbers
- Sub: Para Psychology



THE HUMAN HEART



SKIN

